

# કોરોના વાઇરસ કોવિડ – ૧૯ વૈશ્વિક મહામારી

## નમ્ર અરજ

પ્રતિ,  
શ્રી વિજયભાઇ રૂપાણી  
મુખ્ય મંત્રી શ્રી,  
સ્વર્ણિમ સંકુલ-૧ ૩ જો માળ,  
સચિવાલય, સેક્ટર -૧૦ ગાંધીનગર -૩૮૨૦૧૦  
ફોન – ૨૩૨૫૦૦૭૪

ઈમેલ – [min.vrrupani@gmail.com](mailto:min.vrrupani@gmail.com)

માનનીય શ્રી વિજયભાઇ રૂપાણી,

નમસ્તે,

હાલમાં સમગ્ર વિશ્વમાં અને આપણા દેશમાં કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારી સામે માનવજાત જંગ લડી રહી છે. આ જંગમાં ભારત સરકાર દ્વારા ખુબ જ આવશ્યક અને પ્રસંશનીય પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ મહામારી સામે આપણે સૌ સાથે મળી લડત આપીએ એ પણ આપણા સૌની ફરજ છે.

કોવિડ – ૧૯ કોરોના વાયરસ મહામારીની અસર ગ્રામ્ય વિસ્તારમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો પર અને તેમના ધંધાઓ પર પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં મુખ્યત્વે ખેતી, ખેત મજૂરી , પશુપાલન, હસ્તકલા કારીગરી, છુટક કામ કરનારા, ઘરકામ કરનારા વિગેરે \*\*

મહામારી સામે રક્ષણાત્મક પગલાં તરીકે ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. તેનો સખ્ત અમલ થાય એ પણ અત્યંત જરૂરી છે.

મૂળભૂત રીતે ખેતીકામ આવશ્યક સેવામાં ગણાય આથી મૂળભૂત રીતે બધાં લાભો ખેતીમાં કામ કરનારને મળે એ જરૂરી છે. વળી હાલમાં તારીખ ૨૬ માર્ચ ૨૦૨૦ ના રોજ ભારત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલી ખાસ રાહતો અને પગલાં (યોજના) સેવા સંગઠનની અપીલને અનુરૂપ કરવામાં આવી છે. તેને અમે આવકારીએ છીએ. આ બધાં લાભો ગરીબ કામદાર બહેનો અને તેમનો પરિવાર મેળવે અને હાલના કપરા સંજોગો માંથી બહાર આવવામાં ખુબ જ મદદરૂપ બની રહેશે. આ માટે સેવા સંગઠન ગરીબ કામદાર બહેનો વતી આભાર માનીએ છીએ.

હાલની આ મહામારી સાથે સાથે તારીખ રપ અને ર૬ માર્ચ દરમિયાન ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) થયું હતું. તેને લીધે તૈયાર થઈ રહેલા શિયાળુ ( રવિ પાકો) માં નુકશાન થયું છે. જેમાં ઉભો પાક પલળવો, ખળામાં તૈયાર પાક પલળવો જેથી પાકની ગુણવત્તા પર માઠી અસર પડી છે. આ નુકશાનની સામે તાત્કાલિક અંદાજ મેળવી ને યોગ્ય વીમા વળતર મળે તે ગોઠવણ જરૂરી છે.

શાકભાજી ઉગાડનારા ખેડૂતોને શાકભાજી લાવવા અને વેચવા અંગે હાલાકી ભોગવવી પડે છે. જેવી કે મર્યાદિત સમય માટે બજાર ખુલે છે. તેથી વધુ અફરા તફરી થાય છે. આ માટે કલેક્ટર શ્રી દ્વારા સરકારી વહાનોની શાકભાજી બજારમાં લાવવા લઈ જવા માટે વ્યવસ્થા થાય તેમજ જ્યાં ગામમાં પોતાના વાહનો હોય તેમને આ કામ માટે સત્વરે પાસ આપવામાં આવે જેથી ખેડૂતોના શાકભાજી આ વાહનો મારફતે માર્કેટ ચાર્ડમાં પહોંચાડી શકાય.

- બજારમાં લાવવામાં આવતા શાકભાજીને યોગ્ય ભાવ મળે તે માટે માર્કેટ ચાર્ડ એક્ટ પ્રમાણે પોષણક્ષમ ભાવ ઉગાડનારા ને મળવા જોઈએ. હાલમાં મુઠ્ઠીભર વેપારીઓ આ પરિસ્થિતિનો લાભ લઈ ખુબ જ નીચા ભાવે ખરીદી કરે છે. જે શાકભાજી છુટક વેચાણમાં અત્યંત મોંઘા વેચાઈ રહ્યા છે.
- આપણા અન્નદાતા એવા ખેડૂતો કમોસમી અને પ્રવર્તમાન મહામારી વચ્ચે પોતાની પરવા કર્યા વગર ઉત્પાદિત માલ બજારમાં લાવવા મહેનત કરે છે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી આ દરમિયાન લેવાવી જોઈએ. આ માટે રક્ષણાત્મક પગલાંની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તે પણ આવશ્યક છે.
- માર્કેટ ચાર્ડનો સમય ખુબ મર્યાદિત છે. તે સમયમાં વધારે લોકો ભેગા થવાથી અફરા તફરી સર્જાય છે તે નિવારવા તકેદારીની જરૂર છે.
- શિયાળુ પાકનું વાવેતર થયું છે. તે લગભગ તૈયાર છે. તેના માટે ગામમાંથી ખેતરમાં જવાના સાધનોની અવર જવર માટે સામાજિક અંતર ને ધ્યાનમાં રાખી રક્ષણાત્મક પગલાંની જાગૃતિ સાથે આ કામ માટે છૂટછાટ આપવી જોઈએ. જેથી ખેતરમાં લણવાનું, ટ્રેડિંગનું કામ થઈ શકે. અને પશુ માટે ઘાસચારો પણ લાવવા લઈ જવામાં સરળતા રહે.
- તૈયાર ખેત પેદાશ ખેતરથી ગામથી બજાર સુધી પહોંચાડવા માટે આ સમયમાં સરકારી સાધનો ની વ્યવસ્થા પ્રાપ્ત કરાવવી જોઈએ. નાણા ખેંચ ને કારણે અને વાતાવરણમાં બદલાવને લીધે ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યું છે. આ સંજોગોમાં ખાસ બજાર સુધી તૈયાર પાકો લાવવા માટે વાહન સબસીડી આપવામાં આવે.
- તાત્કાલિક હરાજી શરૂ કરવામાં આવે અને તેની સાથે ખાસ ખેડૂત સંગઠનો જે ખેતીની સખ્વાય ચેઈનમાં સંકળાયેલા છે તેમને પણ ખાસ જોગવાઈ આપવામાં આવે.

- પશુપાલકો માટે વિશેષ ઘાસ ની સાથે સાથે ખાણદાણની વ્યવસ્થા માટે ખાસ યોજના દ્વારા ડેરી મારફતે તેનો પુરવઠો પૂરો પાડીને અપાવવી જોઈએ. અને પશુપાલકો જીવના જોખમે કામ કરતા હોવાથી રક્ષણાત્મક પગલાં પહોચાડવા જોઈએ.
- રેશનીંગ ની દુકાન દ્વારા અનાજ, દાળ વિગેરેનું વિતરણ ૧લી એપ્રિલ થી ૩ મહિના માટે મફત કરવામાં આવનાર છે. તેની સાથે સાથે અન્ય જીવન નિર્વાહની વસ્તુઓ જેવી કે, સાબુ, પાવડર વિગેરે નો સમાવેશ કરવો જરૂરી છે.
- પ્રધાનમંત્રી કિશાન માન ધન યોજના હેઠળ એપ્રિલ મહિનામાં પ્રથમ હમો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સામે આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખરીફ પાક વાવેતરની જરૂરિયાતને ધ્યાને લઈ આ પેકેજ ની રકમ એકી સાથે એક સમય અપાય તે જરૂરી છે.
- કોવિડ ૧૯ રાહત પેકેજ હેઠળ બહેનોને જન ધન ખાતામાં ખાસ ૩ માસ સુધી રૂ. ૫૦૦ ટ્રાન્સફર કરવાના છે. આ નાણાના ઉપયોગ માટે ઘણા બધાં ગામોમાં બેંક વ્યવસ્થા ગામથી આશરે ૭ થી ૧૫ કી.મી કે તેથી વધારે અંતરે હોવાથી ખુબ મુશ્કેલી છે તેની સામે ખાસ ગામના જ આગેવાન સાથે રહીને બેન્કીંગ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.
- હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા તેમજ ખેતમજૂરો માટે પણ વૈકલ્પિક ભંડોળ અને ધિરાણ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બને છે.
- સખી મંડળોને જે વ્યાજ રહિત રૂ. ૧૦ લાખથી ૨૦ લાખ સુધી કાર્યકારી ભંડોળ આપવાની કોવિડ ૧૯ રાહત પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે તેનો લાભ સખી મંડળો ઉપરાંત સ્વૈચ્છિક સંગઠનો દ્વારા રચવામાં આવેલ સહકારી મંડળીઓ, કંપનીઓને પણ આ પ્રકારના વ્યાજ રહિત કાર્યકારી ભંડોળ આપવામાં આવે.
- ખરીફપાક વાવેતર માટે તૈયારી રૂપે ખાતર બિયારણની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
- રવિપાકમાં જીરું, ચણા વિગેરે વિગેરે સરકાર પોતે ટેકાના ભાવે ખરીદે એવી જોગવાઈ થવી જોઈએ.

*R. S. Kiyawel*

રેહના રીયાવાલા  
ઉપ પ્રમુખ, સેવા  
૯૪૨૯૬૧૯૩૩૫

*Chhaya Bhattar*

છાયા ભાવસાર  
સંચાલક, સેવા  
૯૯૭૪૦૨૩૬૦૩